

Namaze Eid Ka Tariqa (Gujarati)



શ્રેણી નંબર: 30

# નમાઝે ઈદ કા તરીકા

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નાત, જાનિયે દા'વતે ઇસ્લામી. હઝરત અલ્લામા મૌલાના અબુ ઝિયાલ

મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ૨-ઝવી کاتب برکاتہم  
العساکریہ

مکتبۃ المدینہ  
(دعوت اسلامی)

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
مَا بَعُدَ قَاعُودًا بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## કિતાબ પઢને કી દુઆ

અઝ : શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી, હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ  
દીની કિતાબ યા ઈસ્લામી સબક પઢને સે પહલે ઝૈલ મેં દી હુઈ દુઆ પઢ લીજિયે اِنَّ شَاءَ اللهُ عَزَّوَجَلَّ જો કુછ પઢેંગે યાદ રહેગા. દુઆ યેહ હૈ :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ  
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

તરજમા : ઐ અલ્લાહ ઈઝ્જલ્ જલ્ ! હમ પર ઈલ્મો હિક્મત કે દરવાઝે ખોલ દે ઓર હમ પર અપની રહમત નાઝિલ ફરમા ! ઐ અ-ઝમત ઓર બુરુગાં વાલે । (المستطرف ج ١، مدار الفكر بيروت)  
નોટ : અવ્વલ આખિર એક એક બાર દુરુદ શરીફ પઢ લીજિયે.

તાલિબે ગમે મદીના

વ બકીઅ

વ મહિરત

13 શવ્વાલુલ મુકર્રમ 1428 હિ.



## નમાઝે ઈદ કા તરીકા

યેહ રિસાલા (નમાઝે ઈદ કા તરીકા)

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઈસ્લામી હઝરત અલ્લામા મૌલાના અબૂ બિલાલ મુહમ્મદ ઈલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી ઝિયાઈ દَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ ને ઉદ્દૂ ઝબાન મેં તહરીર ફરમાયા હૈ.

મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી) ને ઈસ રિસાલે કો ગુજરાતી રસ્મુલ ખત મેં તરતીબ દે કર પેશ ક્રિયા હૈ ઓર મક-ત-બતુલ મદીના સે શાએઅ કરવાયા હૈ. ઈસ મેં અગર કિસી જગહ કમી બેશી પાએં તો મજલિસે તરાજિમ કો (બ ઝરીઅએ મક્તૂબ, ઈ-મેઈલ યા SMS) મુત્તલઅ ફરમા કર સવાબ કમાઈયે.

રાખિતા : મજલિસે તરાજિમ (દા'વતે ઈસ્લામી)

મક-ત-બતુલ મદીના, સિલેકટેડ હાઉસ, અલિફ કી મસ્જિદ કે સામને,

ત્રીન દરવાઝા, અહમદઆબાદ-1, ગુજરાત

MO. 9374031409 • E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## નમાઝે ઈદ કા તરીકા (હ-નફી)

શૈતાન લાખ સુસ્તી દિલાએ યેહ રિસાલા (10 સફહાત) મુકમ્મલ  
પઠ લીજિયે إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ ઈસ કે ફવાઈદ ખુદ હી દેખ લેંગે.

### દુરુદ શરીફ કી ફઝીલત

દો આલમ કે માલિકો મુખ્તાર, મક્કી મ-દની સરકાર, મહબૂબે  
પરવર દગાર صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ને ઈશાદ ફરમાયા : જો મુઝ પર શબે  
જુમુઆ ઓર રોઝે જુમુઆ સો બાર દુરુદ શરીફ પઠે અલ્લાહ તઆલા ઉસ કી  
સો હાજતે પૂરી ફરમાએગા સત્તર આખિરત કી ઓર તીસ દુન્યા કી.

(તારીખ دمشق لابن عساکر ج ٥٤ ص ٣٠١ دار الفکر بیروت)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

### દિલ ઝિન્દા રહેગા

તાજદારે મદીના, કરારે કલ્બો સીના صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ કા  
ફરમાને આલીશાન હૈ : જિસ ને ઈદેન કી રાત (યા'ની શબે ઈદુલ ફિત્ર ઓર  
શબે ઈદુલ અઝહા) ત-લબે સવાબ કે લિયે ક્રિયામ ક્રિયા (યા'ની ઈબાદત મેં ગુઝારા)  
ઉસ દિન ઉસ કા દિલ નહીં મરેગા, જિસ દિન લોગોં કે દિલ મર જાએંગે.

(سَنَنْ إِبْنِ مَاجَه ج ٢ ص ٣٦٥ حَدِيث ١٧٨٢ دَار الْمَعْرِفَةِ بِيْرُوت)

इरमाने मुस्तक़ा : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर अक बार दुइद पाक पढा अल्लाह उस पर दस रकमते बेजता है. (स्म)

## जन्नत वाजिब हो जाती है

अक और मकाम पर हजरते सय्यिदुना मुआज्ज बिन जबल से मरवी है, इरमाते हैं : जो पांय रातों में शब बेदारी करे (या'नी जाग कर ए'बादत में गुजारे) उस के लिये जन्नत वाजिब हो जाती है. ज़िल डिज्जल शरीफ़ की आठवीं, नवीं और दसवीं रात (इस तरह तीन रातें तो येह हुँई) और यौथी एँदुल क़ित्र की रात, पांयवीं शा'बानुल मुअज़्जम की पन्दरहवीं रात (या'नी शबे बराअत). (अत्रुग़िब वलतुरहिब ज २ व १८१ हद़िथ २)

## नमाजे एँद के लिये जाने से कप्ल की सुन्नत

हजरते सय्यिदुना बुरैदा से मरवी है के हुज़ूरे अन्वर, शाइअे महशर, मदीने के ताजवर, बि एँजने रब्बे अकबर गौबों से बा षबर, महबूबे दावर صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ एँदुल क़ित्र के दिन कुछ षा कर नमाज के लिये तशरीफ़ ले जाते थे और एँद अज़्हा के रोज़ नहीं पाते थे जब तक नमाज से इरिग न हो जाते. (सुन्न त़िमूनी ज २ व ७० हद़िथ ६२) और "बुभारी" की रिवायत हजरते सय्यिदुना अनस से है के एँदुल क़ित्र के दिन तशरीफ़ न ले जाते जब तक यन्द् षजूरे न तनावुल इरमा लेते और वोह ताक होतीं. (बुख़ारी ज १ व ३२८ हद़िथ १०३) दारुलक़्तब العلمية بيروت)

## नमाजे एँद के लिये आने जाने की सुन्नत

हजरते सय्यिदुना अबू हु़रैरा से रिवायत है : ताजदारे मदीना, सुइरे कल्बो सीना صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ एँद को (नमाजे एँद के लिये) अक रास्ते से तशरीफ़ ले जाते और दूसरे रास्ते से वापस तशरीफ़ लाते. (सुन्न त़िमूनी ज २ व ६९ हद़िथ ६१)

करमाने मुस्तकी : عَلَى اللَّهِ تَعَالَى غَيْرُ أَبِي رَسْمٍ : श्री शम्स मुज पर दुइदे पाक पढना भूल गया वोड जन्त का रास्ता भूल गया. (جران)

## नमाजे ँद का तरीका (ड-नई)

पडले ँस तरड नय्यत कीजिये : “में नय्यत करता हूं दो रकअत नमाज ँदुल क्त्र (या ँदुल अजूडा) की, साथ छ<sup>6</sup> जाँद तकबीरों के, वासिते अद्लाड كَرَّكَرْ के, पीछे ँस ँमाम के” क्त्र कानों तक डाय उठाँये और अद्लाडु अकबर कड कर डरुभे मा'भूल नाइ के नीये बांध लीजिये और सना पढिये. क्त्र कानों तक डाय उठाँये और अद्लाडु अकबर कडते हुअे लटका दीजिये. क्त्र डाय कानों तक उठाँये और अद्लाडु अकबर कड कर लटका दीजिये. क्त्र कानों तक डाय उठाँये और अद्लाडु अकबर कड कर बांध लीजिये या'नी पडली तकबीर के बा'द डाय बांधिये ँस के बा'द दूसरी और तीसरी तकबीर में लटकाँये और यौथी में डाय बांध लीजिये. ँस को यूं याद रभिये के जडं कियाम में तकबीर के बा'द कुछ पढना है वडं डाय बांधने हें और जडं नडीं पढना वडं डाय लटकाने हें. क्त्र ँमाम तअव्वुज और तस्मिया आडिस्ता पढ कर अल डम्द शरीक और सूरड जडूर (या'नी बुलन्द आवाज) के साथ पढे, क्त्र रुकूअ करे. दूसरी रकअत में पडले अल डम्द शरीक और सूरड जडूर के साथ पढे, क्त्र तीन बार कान तक डाय उठा कर अद्लाडु अकबर कडिये और डाय न बांधिये और यौथी बार बिगैर डाय उठाअे अद्लाडु अकबर कडते हुअे रुकूअ में जाँये और काँद के मुताबिक नमाज मुकम्मल कर लीजिये. डर दो तकबीरों के दरमियान तीन बार “سُبْحَانَ اللَّهِ” कडने की भिकदार युप षडा रहना है.

(अडारे शरीअत, जि. 1, स. 781, ११ ص 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100)

ફરમાને મુસ્તફા ﷺ: جَسَى اللّٰهُ تَعَالَى عَلَيَّوَالَيْهِ وَسَلَّمَ: जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पढ़ा तबकीक  
 वोह बढ भप्त हो गया. (उत्तर)

## નમાઝે ઈદ કિસ પર વાજિબ હૈ ?

ઈદૈન (યા'ની ઈદુલ ફિત્ર ઓર બકર ઈદ) કી નમાઝ વાજિબ હૈ મગર સબ પર નહીં સિફ ઉન પર જિન પર જુમુઆ વાજિબ હૈ. ઈદૈન મેં ન અઝાન હૈ ન ઈકામત. (બહારે શરીઅત, જિ. 1, સ. 779, મક-ત-બતુલ

મદીના બાબુલ મદીના કરાચી, (دَرْمُخْتَار ج ٣ ص ٥١ دار المعرفة بيروت)

## ઈદ કા ખુત્બા સુન્નત હૈ

ઈદૈન કી અદા કી વોહી શર્તે હૈં જો જુમુઆ કી, સિફ ઈતના ફક્ર હૈ કે જુમુઆ મેં ખુત્બા શર્ત હૈ ઓર ઈદૈન મેં સુન્નત. જુમુઆ કા ખુત્બા કબલ અઝ નમાઝ હૈ ઓર ઈદૈન કા બા'દ અઝ નમાઝ.

(બહારે શરીઅત, જિ. 1, સ. 779, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 200, 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210, 211, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 226, 227, 228, 229, 230, 231, 232, 233, 234, 235, 236, 237, 238, 239, 240, 241, 242, 243, 244, 245, 246, 247, 248, 249, 250, 251, 252, 253, 254, 255, 256, 257, 258, 259, 260, 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270, 271, 272, 273, 274, 275, 276, 277, 278, 279, 280, 281, 282, 283, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299, 300, 301, 302, 303, 304, 305, 306, 307, 308, 309, 310, 311, 312, 313, 314, 315, 316, 317, 318, 319, 320, 321, 322, 323, 324, 325, 326, 327, 328, 329, 330, 331, 332, 333, 334, 335, 336, 337, 338, 339, 340, 341, 342, 343, 344, 345, 346, 347, 348, 349, 350, 351, 352, 353, 354, 355, 356, 357, 358, 359, 360, 361, 362, 363, 364, 365, 366, 367, 368, 369, 370, 371, 372, 373, 374, 375, 376, 377, 378, 379, 380, 381, 382, 383, 384, 385, 386, 387, 388, 389, 390, 391, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 401, 402, 403, 404, 405, 406, 407, 408, 409, 410, 411, 412, 413, 414, 415, 416, 417, 418, 419, 420, 421, 422, 423, 424, 425, 426, 427, 428, 429, 430, 431, 432, 433, 434, 435, 436, 437, 438, 439, 440, 441, 442, 443, 444, 445, 446, 447, 448, 449, 450, 451, 452, 453, 454, 455, 456, 457, 458, 459, 460, 461, 462, 463, 464, 465, 466, 467, 468, 469, 470, 471, 472, 473, 474, 475, 476, 477, 478, 479, 480, 481, 482, 483, 484, 485, 486, 487, 488, 489, 490, 491, 492, 493, 494, 495, 496, 497, 498, 499, 500, 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509, 510, 511, 512, 513, 514, 515, 516, 517, 518, 519, 520, 521, 522, 523, 524, 525, 526, 527, 528, 529, 530, 531, 532, 533, 534, 535, 536, 537, 538, 539, 540, 541, 542, 543, 544, 545, 546, 547, 548, 549, 550, 551, 552, 553, 554, 555, 556, 557, 558, 559, 560, 561, 562, 563, 564, 565, 566, 567, 568, 569, 570, 571, 572, 573, 574, 575, 576, 577, 578, 579, 580, 581, 582, 583, 584, 585, 586, 587, 588, 589, 590, 591, 592, 593, 594, 595, 596, 597, 598, 599, 600, 601, 602, 603, 604, 605, 606, 607, 608, 609, 610, 611, 612, 613, 614, 615, 616, 617, 618, 619, 620, 621, 622, 623, 624, 625, 626, 627, 628, 629, 630, 631, 632, 633, 634, 635, 636, 637, 638, 639, 640, 641, 642, 643, 644, 645, 646, 647, 648, 649, 650, 651, 652, 653, 654, 655, 656, 657, 658, 659, 660, 661, 662, 663, 664, 665, 666, 667, 668, 669, 670, 671, 672, 673, 674, 675, 676, 677, 678, 679, 680, 681, 682, 683, 684, 685, 686, 687, 688, 689, 690, 691, 692, 693, 694, 695, 696, 697, 698, 699, 700, 701, 702, 703, 704, 705, 706, 707, 708, 709, 710, 711, 712, 713, 714, 715, 716, 717, 718, 719, 720, 721, 722, 723, 724, 725, 726, 727, 728, 729, 730, 731, 732, 733, 734, 735, 736, 737, 738, 739, 740, 741, 742, 743, 744, 745, 746, 747, 748, 749, 750, 751, 752, 753, 754, 755, 756, 757, 758, 759, 760, 761, 762, 763, 764, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773, 774, 775, 776, 777, 778, 779, 780, 781, 782, 783, 784, 785, 786, 787, 788, 789, 790, 791, 792, 793, 794, 795, 796, 797, 798, 799, 800, 801, 802, 803, 804, 805, 806, 807, 808, 809, 810, 811, 812, 813, 814, 815, 816, 817, 818, 819, 820, 821, 822, 823, 824, 825, 826, 827, 828, 829, 830, 831, 832, 833, 834, 835, 836, 837, 838, 839, 840, 841, 842, 843, 844, 845, 846, 847, 848, 849, 850, 851, 852, 853, 854, 855, 856, 857, 858, 859, 860, 861, 862, 863, 864, 865, 866, 867, 868, 869, 870, 871, 872, 873, 874, 875, 876, 877, 878, 879, 880, 881, 882, 883, 884, 885, 886, 887, 888, 889, 890, 891, 892, 893, 894, 895, 896, 897, 898, 899, 900, 901, 902, 903, 904, 905, 906, 907, 908, 909, 910, 911, 912, 913, 914, 915, 916, 917, 918, 919, 920, 921, 922, 923, 924, 925, 926, 927, 928, 929, 930, 931, 932, 933, 934, 935, 936, 937, 938, 939, 940, 941, 942, 943, 944, 945, 946, 947, 948, 949, 950, 951, 952, 953, 954, 955, 956, 957, 958, 959, 960, 961, 962, 963, 964, 965, 966, 967, 968, 969, 970, 971, 972, 973, 974, 975, 976, 977, 978, 979, 980, 981, 982, 983, 984, 985, 986, 987, 988, 989, 990, 991, 992, 993, 994, 995, 996, 997, 998, 999, 1000)

## નમાઝે ઈદ કા વક્ત

ઈન દોનોં નમાઝોં કા વક્ત સૂરજ કે બ કદર એક નેઝા બુલન્દ હોને (યા'ની તુલૂએ આફતાબ કે 20 મિનટ કે બા'દ) સે ઝહૂવએ કુબ્રા યા'ની નિસ્કુન્નહારે શર-ઈ તક હૈ મગર ઈદુલ ફિત્ર મેં દેર કરના ઓર ઈદુલ અઝ્હા જલ્દ પઢના મુસ્તહબ હૈ.

(બહારે શરીઅત, જિ. 1, સ. 781, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 200, 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210, 211, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 226, 227, 228, 229, 230, 231, 232, 233, 234, 235, 236, 237, 238, 239, 240, 241, 242, 243, 244, 245, 246, 247, 248, 249, 250, 251, 252, 253, 254, 255, 256, 257, 258, 259, 260, 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270, 271, 272, 273, 274, 275, 276, 277, 278, 279, 280, 281, 282, 283, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299, 300, 301, 302, 303, 304, 305, 306, 307, 308, 309, 310, 311, 312, 313, 314, 315, 316, 317, 318, 319, 320, 321, 322, 323, 324, 325, 326, 327, 328, 329, 330, 331, 332, 333, 334, 335, 336, 337, 338, 339, 340, 341, 342, 343, 344, 345, 346, 347, 348, 349, 350, 351, 352, 353, 354, 355, 356, 357, 358, 359, 360, 361, 362, 363, 364, 365, 366, 367, 368, 369, 370, 371, 372, 373, 374, 375, 376, 377, 378, 379, 380, 381, 382, 383, 384, 385, 386, 387, 388, 389, 390, 391, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 401, 402, 403, 404, 405, 406, 407, 408, 409, 410, 411, 412, 413, 414, 415, 416, 417, 418, 419, 420, 421, 422, 423, 424, 425, 426, 427, 428, 429, 430, 431, 432, 433, 434, 435, 436, 437, 438, 439, 440, 441, 442, 443, 444, 445, 446, 447, 448, 449, 450, 451, 452, 453, 454, 455, 456, 457, 458, 459, 460, 461, 462, 463, 464, 465, 466, 467, 468, 469, 470, 471, 472, 473, 474, 475, 476, 477, 478, 479, 480, 481, 482, 483, 484, 485, 486, 487, 488, 489, 490, 491, 492, 493, 494, 495, 496, 497, 498, 499, 500, 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509, 510, 511, 512, 513, 514, 515, 516, 517, 518, 519, 520, 521, 522, 523, 524, 525, 526, 527, 528, 529, 530, 531, 532, 533, 534, 535, 536, 537, 538, 539, 540, 541, 542, 543, 544, 545, 546, 547, 548, 549, 550, 551, 552, 553, 554, 555, 556, 557, 558, 559, 560, 561, 562, 563, 564, 565, 566, 567, 568, 569, 570, 571, 572, 573, 574, 575, 576, 577, 578, 579, 580, 581, 582, 583, 584, 585, 586, 587, 588, 589, 590, 591, 592, 593, 594, 595, 596, 597, 598, 599, 600, 601, 602, 603, 604, 605, 606, 607, 608, 609, 610, 611, 612, 613, 614, 615, 616, 617, 618, 619, 620, 621, 622, 623, 624, 625, 626, 627, 628, 629, 630, 631, 632, 633, 634, 635, 636, 637, 638, 639, 640, 641, 642, 643, 644, 645, 646, 647, 648, 649, 650, 651, 652, 653, 654, 655, 656, 657, 658, 659, 660, 661, 662, 663, 664, 665, 666, 667, 668, 669, 670, 671, 672, 673, 674, 675, 676, 677, 678, 679, 680, 681, 682, 683, 684, 685, 686, 687, 688, 689, 690, 691, 692, 693, 694, 695, 696, 697, 698, 699, 700, 701, 702, 703, 704, 705, 706, 707, 708, 709, 710, 711, 712, 713, 714, 715, 716, 717, 718, 719, 720, 721, 722, 723, 724, 725, 726, 727, 728, 729, 730, 731, 732, 733, 734, 735, 736, 737, 738, 739, 740, 741, 742, 743, 744, 745, 746, 747, 748, 749, 750, 751, 752, 753, 754, 755, 756, 757, 758, 759, 760, 761, 762, 763, 764, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773, 774, 775, 776, 777, 778, 779, 780, 781, 782, 783, 784, 785, 786, 787, 788, 789, 790, 791, 792, 793, 794, 795, 796, 797, 798, 799, 800, 801, 802, 803, 804, 805, 806, 807, 808, 809, 810, 811, 812, 813, 814, 815, 816, 817, 818, 819, 820, 821, 822, 823, 824, 825, 826, 827, 828, 829, 830, 831, 832, 833, 834, 835, 836, 837, 838, 839, 840, 841, 842, 843, 844, 845, 846, 847, 848, 849, 850, 851, 852, 853, 854, 855, 856, 857, 858, 859, 860, 861, 862, 863, 864, 865, 866, 867, 868, 869, 870, 871, 872, 873, 874, 875, 876, 877, 878, 879, 880, 881, 882, 883, 884, 885, 886, 887, 888, 889, 890, 891, 892, 893, 894, 895, 896, 897, 898, 899, 900, 901, 902, 903, 904, 905, 906, 907, 908, 909, 910, 911, 912, 913, 914, 915, 916, 917, 918, 919, 920, 921, 922, 923, 924, 925, 926, 927, 928, 929, 930, 931, 932, 933, 934, 935, 936, 937, 938, 939, 940, 941, 942, 943, 944, 945, 946, 947, 948, 949, 950, 951, 952, 953, 954, 955, 956, 957, 958, 959, 960, 961, 962, 963, 964, 965, 966, 967, 968, 969, 970, 971, 972, 973, 974, 975, 976, 977, 978, 979, 980, 981, 982, 983, 984, 985, 986, 987, 988, 989, 990, 991, 992, 993, 994, 995, 996, 997, 998, 999, 1000)

## ઈદ કી અધૂરી જમાઅત મિલી તો.....?

પહલી રકઅત મેં ઈમામ કે તકબીરેં કહને કે બા'દ મુક્તદી શામિલ હુવા તો ઉસી વક્ત (તકબીરે તહરીમા કે ઈલાવા મઝીદ) તીન તકબીરેં કહ લે અગર્યે ઈમામ ને કિરાઅત શુરૂઅ કર દી હો ઓર તીન હી કહે અગર્યે ઈમામ ને તીન સે ઝિયાદા કહી હોં ઓર અગર ઈસ ને તકબીરેં ન કહીં કે ઈમામ રુકૂઅ મેં ચલા ગયા તો ખડે ખડે ન કહે બલકે ઈમામ કે સાથ રુકૂઅ મેં જાએ ઓર રુકૂઅ મેં તકબીરેં કહ લે ઓર અગર ઈમામ કો રુકૂઅ મેં

ફરમાને મુસ્તફા ﷺ : जिस نے मुझ पर दस मरतबा सुबह और दस मरतबा शाम दुइद पक पढा।  
(उसे क्रियामत के दिन मेरी शक्राअत मिलेगी. (अनुवाद))

પાયા ઓર ગાલિબ ગુમાન હૈ કે તકબીરેં કહ કર ઈમામ કો રુકૂઅ મેં પા લેગા તો ખડે ખડે તકબીરેં કહે ફિર રુકૂઅ મેં જાએ વરના અલ્લાહુ અકબર કહ કર રુકૂઅ મેં જાએ ઓર રુકૂઅ મેં તકબીરેં કહે ફિર અગર ઈસ ને રુકૂઅ મેં તકબીરેં પૂરી ન કી થીં કે ઈમામ ને સર ઉઠા લિયા તો બાકી સાકિત હો ગઈ (યા'ની બકિય્યા તકબીરેં અબ ન કહે) ઓર અગર ઈમામ કે રુકૂઅ સે ઉઠને કે બા'દ શામિલ હુવા તો અબ તકબીરેં ન કહે બલ્કે (ઈમામ કે સલામ ફેરને કે બા'દ) જબ અપની (બકિય્યા) પઢે ઉસ વક્ત કહે ઓર રુકૂઅ મેં જહાં તકબીર કહના બતાયા ગયા ઉસ મેં હાથ ન ઉઠાએ ઓર અગર દૂસરી રક્અત મેં શામિલ હુવા તો પહલી રક્અત કી તકબીરેં અબ ન કહે બલ્કે જબ અપની ફૌત શુદા પઢને ખડા હો ઉસ વક્ત કહે. દૂસરી રક્અત કી તકબીરેં અગર ઈમામ કે સાથ પા જાએ ફબિહા (યા'ની તો બેહતર). વરના ઈસ મેં ભી વોહી તફસીલ હૈ જો પહલી રક્અત કે બારે મેં મઝકૂર હુઈ. (બહારે શરીઅત, જિ. 1, સ. 782,

نَدْمُخْتَار ج ٣ ص ٦٤، عالمگیری ج ١ ص ١٠١)

## ઈદ કી જમાઅત ન મિલી તો ક્યા કરે ?

ઈમામ ને નમાઝ પઢ લી ઓર કોઈ શપ્સ બાકી રહ ગયા ખ્વાહ વોહ શામિલ હી ન હુવા થા યા શામિલ તો હુવા મગર ઉસ કી નમાઝ ફાસિદ હો ગઈ તો અગર દૂસરી જગહ મિલ જાએ પઢ લે વરના (બિગૈર જમાઅત કે) નહીં પઢ સકતા. હાં બેહતર યેહ હૈ કે યેહ શપ્સ ચાર રક્અત ચાશત કી નમાઝ પઢે.

(نَدْمُخْتَار ج ٣ ص ٦٧)

## ઈદ કે ખુલ્બે કે અહકામ

નમાઝ કે બા'દ ઈમામ દો ખુલ્બે પઢે ઓર ખુલ્બએ જુમુઆ મેં જો ચીઝેં સુન્નત હેં ઈસ મેં ભી સુન્નત હેં ઓર જો વહાં મકરૂહ યહાં ભી મકરૂહ.

ફરમાને મુસ્તફા : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्इद शरीफ़ न पढा उस ने जफ़ा की. (عبدالرزاق)

સિર્ફ દો બાતોં મેં ફર્ક હૈ એક યેહ કે જુમુઆ કે પહલે ખુત્બે સે પેશ્તર ખતીબ કા બૈઠના સુન્નત થા ઓર ઈસ મેં ન બૈઠના સુન્નત હૈ. દૂસરે યેહ કે ઈસ મેં પહલે ખુત્બે સે પેશ્તર 9 બાર ઓર દૂસરે કે પહલે 7 બાર ઓર મિમ્બર સે ઉતરને કે પહલે 14 બાર અલ્લાહુ અકબર કહના સુન્નત હૈ ઓર જુમુઆ મેં નહીં.

(બહારે શરીઅત, જિ. 1, સ. 783, 100, عالمگیری ج 1 ص 100)

**ઈસ મુબારક મિસ્રઅ, “દે દો ઈદી મેં ગમ મદીને કા”**  
**કે બીસ હુરૂફ કી નિસ્બત સે ઈદ કે 20 આદાબ**  
**ઈદ કે દિન યેહ ઉમૂર મુસ્તહબ હૈં :**

❁ હજામત બનવાના (મગર ઝુલ્ફેં બનવાઈયે ન કે ઈંગ્રેઝી બાલ)

❁ નાખુન તરશ્વાના ❁ ગુસ્લ કરના ❁ મિસ્વાક કરના (યેહ ઉસ કે ઈલાવા હૈ જો વુઝૂ મેં કી જાતી હૈ) ❁ અચ્છે કપડે પહનના, નએ હોં તો નએ વરના ધુલે હુએ ❁ ખુશૂ લગાના ❁ અંગૂઠી પહનના (જબ કભી અંગૂઠી પહનિયે તો ઈસ બાત કા ખાસ ખયાલ રખિયે કે સિર્ફ સાઢે ચાર માશે સે કમ વઝૂન ચાંદી કી એક હી અંગૂઠી પહનિયે. એક સે ઝિયાદા ન પહનિયે ઓર ઉસ એક અંગૂઠી મેં ભી નગીના એક હી હો, એક સે ઝિયાદા નગીને ન હોં, બિગૈર નગીને કી ભી મત પહનિયે. નગીને કે વઝૂન કી કોઈ કેંદ નહીં. ચાંદી કા છલ્લા યા ચાંદી કે બયાન કર્દા વઝૂન વગૈરા કે ઈલાવા કિસી ભી ધાત કી અંગૂઠી યા છલ્લા મર્દ નહીં પહન સકતા) ❁ નમાઝે ફજ મસ્જિદે મહલ્લા મેં પઢના ❁ ઈદુલ ફિત્ર કી નમાઝ કો જાને સે પહલે ચન્દ ખજૂરેં ખા લેના, તીન, પાંચ, સાત યા કમોબેશ મગર તાક હોં. ખજૂરેં ન હોં તો કોઈ મીઠી ચીઝ ખા લીજિયે. અગર નમાઝ સે પહલે કુછ ભી ન ખાયા તો ગુનાહ ન





ફરમાને મુસ્તફા ﷺ: حَسْبِيَ اللَّهُ تَعَالَى عَلَيْهِ وَاسَّلَمُ : મુઝ પર દુરુદ પાક કી કસરત કરો બેશક યેહ તુમ્હારે લિયે તહારત હૈ. (બુઝાઈ)

## બકર ઈદ કા એક મુસ્તહબ

ઈદે અઝ્હા (યા'ની બકર ઈદ) તમામ અહકામ મેં ઈદુલ ફિત્ર (યા'ની મીઠી ઈદ) કી તરહ હૈ. સિફ બા'ઝ બાતોં મેં ફર્ક હૈ, મ-સલન ઈસ મેં (યા'ની બકર ઈદ મેં) મુસ્તહબ યેહ હૈ કે નમાઝ સે પહલે કુછ ન ખાએ યાહે કુરબાની કરે યા ન કરે ઓર અગર ખા લિયા તો કરાહત ભી નહીં.

(عالمگیری ج ۱ ص ۱۰۲ دارالفکر بیروت)

## “અલ્લાહુ અકબર” કે આઠ હુરુફ કી નિસ્બત સે તકબીરે તશરીક કે 8 મ-દની ફૂલ

❖ નવીં ઝુલ હિજ્જતિલ હરામ કી ફજ્જ સે તેરહવીં કી અસ્ર તક પાંચોં વક્ત કી ફર્ઝ નમાઝોં જો મસ્જિદ કી જમાઅતે મુસ્તહબ્બા કે સાથ અદા કી ગઈ ઉન મેં એક બાર બુલન્દ આવાઝ સે તકબીર કહના વાજિબ હૈ ઓર તીન બાર અફઝલ ઈસે તકબીરે તશરીક કહતે હેં. ઓર વોહ યેહ હૈ :

اللَّهُ أَكْبَرُ ط اللَّهُ أَكْبَرُ ط لَا إِلَهَ إِلَّا اللَّهُ وَ اللَّهُ أَكْبَرُ ط اللَّهُ أَكْبَرُ ط وَلِلَّهِ الْحَمْدُ  
(બહારે શરીઅત, જિ. 1, સ. 779 તા 785, ૧૧, ૩૨)

❖ તકબીરે તશરીક સલામ ફેરને કે બા'દ ફૌરન કહના વાજિબ હૈ. યા'ની જબ તક કોઈ એસા ફે'લ ન કિયા હો કે ઉસ પર નમાઝ કી બિના ન કર સકે મ-સલન અગર મસ્જિદ સે બાહર હો ગયા યા કસ્દન વુઝૂ તોડ દિયા યા યાહે ભૂલ કર હી કલામ કિયા તો તકબીર સાકિત હો ગઈ ઓર બિલા કસ્દ વુઝૂ ટૂટ ગયા તો કહ લે. (دُرْمُخْتَارُ وَرَدُّ الْمُخْتَارِ ج ۳ ص ۷۳ دارالمعرفة بیروت)

❖ તકબીરે તશરીક ઉસ પર વાજિબ હૈ જો શહર મેં મુકીમ હો યા જિસ ને ઈસ મુકીમ કી ઈક્તિદા કી. વોહ ઈક્તિદા કરને વાલા યાહે મુસાફિર હો યા ગાઉ કા રહને વાલા ઓર અગર ઉસ કી ઈક્તિદા ન કરેં તો ઉન પર

करमाने मुस्तफ़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : तुम जहां भी हो मुज पर दुइद पढो के तुम्हारा दुइद मुज तक पढींयता है. (परान)

(या'नी मुसाफ़िर और गाँउ के रहने वाले पर) वाजिब नहीं. (दु'मख्तार 3 व 74)

✽ मुकीम ने अगर मुसाफ़िर की इक्तिदा की तो मुकीम पर वाजिब है

अगर्ये इस मुसाफ़िर इमाम पर वाजिब नहीं. (दु'मख्तार 3 व 74)

✽ नफ़ल, सुन्नत और वित्र के बा'द तक़ीर वाजिब नहीं.

(बहारे शरीअत, जि. 1, स. 785, 73 व 3 व 74)

✽ जुमुआ के बा'द वाजिब है और नमाजे (बकर) ँद के बा'द भी कल ले. (औज़न)

✽ मरबूक (जिस की ओक या आँद रकअतें इत हूँ) पर तक़ीर वाजिब है मगर जब फ़ुद सलाम इरे उस वक्त कले. (दु'मख्तार 3 व 76)

✽ मुन्फ़रिद (या'नी तन्हा नमाज पढने वाले) पर वाजिब नहीं.

(अजुहरे नबीरे 122 व 123) मगर कल ले के साइबैन (या'नी इमाम अबू यूसुफ़ और इमाम मुहम्मद صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ) के नजदीक इस पर भी वाजिब है.

(बहारे शरीअत, जि. 1, स. 786)

(इँद के इजाँल वगैरा की तक़ीली मा'लूमात के लिये इँजाने सुन्नत के बाब "इँजाने र-मजान" से इँजाने इँदुल इत्र का मुता-लआ इरमाँये)

औ इमारे प्यारे अल्लाह عَزَّ وَجَلَّ इमें इँदे सँद की फ़ुशियां सुन्नत के मुताबिक मनाने की तौफ़ीक अता इरमा. और इमें इज शरीफ़ और दियारे मदीना व ताजदारे मदीना صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ की दीद की इकीकी इँद बार बार नसीब इरमा. اٰمِيْنَ بِجَاہِ النَّبِيِّ الْاَمِيْنَ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

तेरी जब के दीद होगी जभी मेरी इँद होगी

मेरे प्वाब में तू आना म-दनी मदीने वाले



أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَأَقْرَبَ النَّاسِ إِلَى اللَّهِ مِنَ النَّاسِ الرَّجِيئِينَ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## સુન્નત કી બહારે

તબ્લીગે કુરઆનો સુન્નત કી આલમગીર ગૈર સિયાસી તહરીક દા'વતે ઈસ્લામી કે મહકે મહકે મ-દની માહોલ મેં બ કસરત સુન્નતેં સીખી ઓર સિખાઈ જતી હૈં, હર જુમા'રાત ઈશા કી નમાઝ કે બા'દ આપ કે શહર મેં હોને વાલે દા'વતે ઈસ્લામી કે હફતાવાર સુન્નતોં ભરે ઈજતિમાએ મેં રિઝાએ ઈલાહી કે લિયે અચ્છી અચ્છી નિય્યતોં કે સાથ સારી રાત ગુઝારને કી મ-દની ઈલ્તિજા હૈ. આશિકાને રસૂલ કે મ-દની કાફિલોં મેં બ નિય્યતે સવાબ સુન્નતોં કી તરબિય્યત કે લિયે સફર ઓર રોઝાના ફિકે મદીના કે ઝરીએ મ-દની ઈન્આમાત કા રિસાલા પુર કર કે હર મ-દની માહ કે ઈન્તિદાઈ દસ દિન કે અન્દર અન્દર અપને યહાં કે ઝિમ્મેદાર કો જમ્બ કરવાને કા મા'મૂલ બના લીજિયે, **إِنَّ اللَّهَ بِكُمْ لَعَنٌ** ઈસ કી બ-ર-કત સે પાબન્દે સુન્નત બનને, ગુનાહોં સે નફરત કરને ઓર ઈમાન કી હિકાઝત કે લિયે કુઠને કા ઝેહન બનેગા.

હર ઈસ્લામી ભાઈ અપના યેહ ઝેહન બનાએ કે **“મુઝે અપની ઓર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કરની હૈ. إِنَّ اللَّهَ بِكُمْ لَعَنٌ”** અપની ઈસ્લાહ કી કોશિશ કે લિયે **“મ-દની ઈન્આમાત”** પર અમલ ઓર સારી દુન્યા કે લોગોં કી ઈસ્લાહ કી કોશિશ કે લિયે **“મ-દની કાફિલોં”** મેં સફર કરના હૈ. **إِنَّ اللَّهَ بِكُمْ لَعَنٌ**

### મક-ત-બતુલ મદીના કી શાખેં

સુરત : વલિયાભાઈ મસ્જિદ, ખ્વાજા દાના દરગાહ કે પાસ.

જામનગર : પાંચ હાટડી

મોડાસા : સુકા બજાર

ગાંધીધામ : સપના નગર, મદીના મસ્જિદ કે પાસ

ધોલકા : તાજદારે મદીના મસ્જિદ કે સામને, ટાવર બાઝાર

### મક-ત-બતુલ મદીના

દા'વતે ઈસ્લામી



ફેઝાલે મદીના, શ્રી કોનિયા બગીચે કે સામને, મિરઝાપૂર, અહમદાબાદ, ગુજરાત, ઇન્ડિયા  
Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net